

ઇન્ટરનેશનલ કેડિટ કાર્ડના ઉપયોગમાં વધુ ઉદારીકરણ

30 જાન્યુઆરી, 2003

ભારતીય નિવાસીઓ વ્યક્તિગતની સાથે-સાથે કોર્પોરેટસ પણ હવે ઇન્ટરનેશનલ કેડિટ કાર્ડ ભારતના કોઈ પણ કાર્ડ ઇસ્યુઅર પાસેથી મેળવી શકશે. આવા કાર્ડની સામે કેડિટની મર્યાદા જેતે કાર્ડ આપનારાઓ પોતાની રીતે નક્કી કરશે.

અન્ય ઉદારીકરણના પગલાં રૂપે નિવાસીના ચાલુ ખાતામાંથી ફોરેન એક્સચેન્જ ટ્રાન્ઝેક્શન માટે નિર્ણય લેવામાં આવ્યો છે કે વર્ષ દીઠ 10,000 યુએસ ડોલર્સ પ્રાઇવેટ ટ્રાવેલ માટે તેમજ 25,000 યુએસ ડોલર્સ બિઝનેસ ટ્રાવેલ કે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ / ટ્રેઇનીંગ / મેડિકલ ટ્રીટમેન્ટ માટે રિઝર્વ બેન્કની પ્રાથમિક મંજૂરી ઇન્ટરનેશનલ કેડિટ કાર્ડ મારફત થતા ખર્ચ માટે લેવાની રહેશે નહીં. કાર્ડ આપનારાની ચોક્કસ કેડિટ મર્યાદા પૂરતી ભારતીય નિવાસી માટે આ સુવિધા ઉપલબ્ધ બનશે.

એ સ્પષ્ટ કરવામાં આવે છે કે, ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (ફેમા) હેઠળ રિઝર્વ બેંક કેડિટ કાર્ડ મારફત વિદેશમાં કે દેશમાં થતાં ખર્ચની કોઈ મર્યાદા નિશ્ચિત કરી નથી.

27 જૂન, 2002 ના રોજ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના એપી (ડીઆઇઆર સિરીઝ) સરકયુલર નં. 53માં જાહેર કર્યા મુજબ ઇન્ટરનેશનલ કેડિટ કાર્ડથી પ્રવાસને લગતા અન્ય ખર્ચ પણ ઇન્ટરનેટ દ્વારા થઈ શકશે. ભારતમાં માન્યતા પ્રાપ્ત ડિલર્સ પાસેથી જ આ વ્યવહાર કરવાના રહેશે. કેડિટ કાર્ડ મારફત ઇન્ટરનેટ પરથી પુસ્તકો મંગાવવા, ડાઉનલોડ થઈ શકે તેવા સોફ્ટવેર ખરીદવા અથવા 'એકિઝમ' પોલિસી અંતર્ગત મંજૂરી આપવામાં આવી હોય તેવી વસ્તુઓ ખરીદી શકાય છે. આ માટેની કોઈ અલગથી રકમની મર્યાદા દર્શાવવામાં આવી નથી.

એ પછી સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ઇન્ટરનેશનલ કેડિટકાર્ડ પ્રતિબંધિત વસ્તુઓ ખરીદવા માટે વાપરી શકાશે નહીં. જેમ કે, લોટરીની ટિકિટ, પ્રતિબંધિત મેગેઝિન, કોલ બેક સર્વિસના પેમેન્ટ, વગેરે પ્રવૃત્તિ કે વસ્તુઓ માટે ફોરેન એક્સચેન્જની મંજૂરી નથી.

અલ્પના કિલ્લાવાલા
મહા પ્રબંધક

પ્રેસ રિલીઝ : 2002-2003/800